

PSL/CS/SE/REG-47/24-25
31st October, 2024

Corporate Relationship Department
BSE Limited
1st Floor, P. J. Towers
Dalal Street,
Mumbai - 400 001.

COMPANY CODE NO:-4166 (SCRIP CODE : 513511)

Sub: Publication of extract of Unaudited Financial Results for the quarter and half-year period ended 30th September, 2024
Ref: Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the newspaper clippings of the extract of the Unaudited Financial Results of the Company for the quarter and half-year period ended 30th September, 2024 published on 31st October, 2024 in Indian Express & Business Standard (English) and Financial Express & Loksatta-Jansatta (Gujarati).

You are requested to kindly take the above on your records.

Thanking You,

Yours faithfully
For **Panchmahal Steel Limited**

DEEPAK
RAMAKANT
NAGAR
Deepak Nagar
GM (Legal) & Company Secretary



Digitally signed by DEEPAK
RAMAKANT NAGAR
Date: 2024.10.31 10:44:33
+05'30'

E-mail : shares@panchmahalsteel.co.in

Encl : as above

Dakshin Gujarat Viji Company Limited
CIN U40102GJ2009SGC042909
Regd. & Corp. Office - 'Urja Sadar',
N.V.Road, Kapodera Char Rasta, Surat 395 006 GUJARAT
DGVCL Toll Free No.19123 (or 1800 233 3003)

Tender Notice
Tender details are put up on www.dgvcl.com (to view & download tender documents) and <https://tender.dgvcl.com> (to view, download and online tender submission).

Sr.No.	Tender No.
1	DGVCL/SP/2541/HT Static Inverter Meter
2	DGVCL/SP/2521/M S Bolts & Nuts
3	DGVCL/SP/2504/S.L.T.C of 22KV RIMU Work
4	DGVCL/SP/2511/G.I.Plan Wire & G.I Stay Wire
5	DGVCL/SP/2529/11KV Disc Hardware
6	DGVCL/SP/2503/S.L.T.C of 11KV RIMU Work
7	DGVCL/SP/2455/S.L.T.C of 11KV Load Break Switch (LBS)
8	DGVCL/SP/2502/22 KV A.S. Switches
9	DGVCL/SP/2509/10C X.S.S. mm2 Armored PVC Control Cable
10	DGVCL/SP/2533/22 KV D.O. Fuse

Note: Bidders/vendors may visit the above website/s for regular updates till opening of the tender.
ACE (P), DGVCL, Surat.

Road & Building Department
Government of Gujarat
Tender Notice No. 43/2024-25

On behalf of Governor of Gujarat State the Executive Engineer, R&B Division, Smith Bunglow, Opp. Officer's Club, Collage Road, Bhuj (Kachchh) Ph. No. (02832) 251450 / 250424 invites online tender for the works mentioned below from the contractors registered in appropriate class as mentioned below.

No.	Name of work	Estimate Lac	Contractor's 'Class-D' or Above
1	SR to Re develop of Existing Road and Construction of New CC Road of Circuit House Mandvi, Ta, Mandvi Dist, Kachchh	57.99	
2	SR to Widening Grub at Bhachau Kutch (Providing Plaster, Painting, Plumbing work in VVIP and General Rooms, Parking Shed and other misc. items)	55.24	-- As Above--

Tender for the work will be available from dt. 29/10/2024 to dt. 16/11/2024 on our website: tender.dgvcl.com Bidders are instructed to upload all required documents online by scanning.
For further details, please contact on our above mentioned office address & for online submission of tender please visit our website mentioned above.
Right to reject the tender is reserved.
DDI-KUTCH-785/2024-25

Gujarat Water Supply and Sewerage Board, Gandhinagar
SHORT TENDER NOTICE NO.02/2024 -25(2nd Attempt)
Tender ID No.123198

Executive Engineer, P. H. Mech. Division, G Block, Nandan Arcade Road, Modasa Road, Lunawada Dist: Mahisagar invite on line tender by E-tendering system from registered Govt. Contractor in appropriate class for Comprehensive Operation & Maintenance of pumping Machineries of Hindloiya Water supply Scheme for Total estimated cost of 16.49 Lacs. The last date of down loading & uploading tender document dated 07-11-2024 up to 18.00 hrs. For further details of tender notice, scope of work & specification & further any amendment made will be disburse only on to web Site. www.nprocure.com & also details available during office hours at above office address.
For the Village level Water supply complain Villagers are requested to use helpline Toll Free No.1916
INF-GODHRA-493-2024

OFFICE OF THE ENGINEER-IN-CHIEF (CIVIL), ODISHA,
NIRMAL SODHA, UNIT-V, BHUBANESWAR
E-mail: IDCbuilding@odcplmail.com, odcplmail@odcplmail.com, Tel.: 0674-2391523

INVITATIONS FOR BIDS (IFB)
File No: Od/14/11/2023 Lr. No. 40545 Bhubaneswar, dt. 24 Oct, 2024
Invitation for Bids
Bid Identification No. C.E. (B) - 15/2024-25

1. The Chief Engineer (Buildings), Odisha, Bhubaneswar, on behalf of Governor of Odisha, invites proposals, on bid in double cover system as per O.D.N. 30/02 form eligible contractors for building work as mentioned below.

No.	Name of work	Building works
1.	No. of work	NA
2.	Estimate (Lacs)	NA
3.	Class of Contractor	'A' / Special Class
4.	Availability of bid document in the website	From dt.02.11.2024 to 17.00 Hours of dt. 18.11.2024
5.	Date of opening of Bid	On 18.11.2024 at 11:30 AM.

8. The Bidders have to participate in ONLINE bidding with the tender details can be seen from the website: <https://tenders.odisha.gov.in>. Any addendum/corrigendum/cancellation of tender can also be seen in the said website only.
OIPR-34117/11/0032/2425

Giant Leap towards Multi-dimensional Growth Sardar Patel Good Governance CM Fellowship

Government of Gujarat Welcomes Young Aspirants

This program will engage creative and innovative minds of youth to enhance the state administration

Project

- CM fellows will contribute to projects with their innovative ideas and unique skills

Training

- CM Fellows to undergo 2-week training designed jointly by GOG and IIM-Ahmedabad
- CM Fellows to undergo 2-weeks training in various departments of the state

Selection of Candidates

- Candidates under 35 years of age having at least 60% marks in graduation along with minimum 3 years of experience
- Evaluation process of candidates for CM fellowship will be undertaken through the selection committee
- IIM-Ahmedabad experts to be a part of the Committee

Programme Features

- Monthly stipend of ₹1 lakh
- Fellowship period would be for 1 year (It can be extended for another year depending upon evaluation and mutual agreement)
- Certificates will be conferred jointly by the Government of Gujarat and IIM-Ahmedabad

Be a part of 'Sardar Patel Good Governance CM Fellowship' to Become active participants in the development of Gujarat!

Application Period

Date: 18th November 2024, from 2:00 PM to 17th December 2024, until 11:59 PM

To apply online

<https://spipa.gujarat.gov.in>

Government of Gujarat welcomes youth, to make the dreams of development come true

GUJARAT COTEX LIMITED
Rs. in Lakhs

Regd. Office: Shop No. 4, 1st Floor, Shant Complex, Opp. Patel Pump, Amli, Silvassa - 396230, M. 93279 77729
Email: jayprabha@cotexmail.com, Website: www.cotex.com, Corporate Identity Number: L1711SDN1596PL0000116

Extract of Un-Audited Financial Result for Period Ended 30/09/2024

Particulars	Quarter ended 30/09/2024	Half Year ended 30/09/2024	Corresponding 3 Months ended on 30/09/2023
Total Income from operations	520.44	1233.16	395.04
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	13.53	33.67	2.21
Equity Share Capital	712.20	712.20	712.20
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet			-48.92
Earnings Per Share (of Rs. 5/- each) (For continuing & discontinued operations):			
1. Basic:	0.10	0.24	0.02
2. Diluted:	0.10	0.24	0.02

Note: The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange at <http://www.bseindia.com> and also on website of the listed entity.

For Gujarat Cotex Limited
Shalishkumar Jayantkumar Parekh
Managing Director (DIN: 01246270)

Place: Surat
Date: 29/10/2024

Panchmahal Steel Limited

Registered Office: GIDC Industrial Estate, Kalo-389 330, Dist. Panchmahals, Gujarat.
CIN: L27104GJ1972PLC002153, Phone No: 02676-230777, Fax No: 02676-230889
Email: shahines@panchmahalsteel.co.in, Website: www.panchmahalsteel.co.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024 (Rs. in Lakhs)

Sl. No.	Particulars	Quarter ended 30-09-2024	Half Year ended 30-09-2024	Corresponding 3 months ended in the previous year 30-09-2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Revenue	9,998.26	19,879.34	12,034.16
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	245.92	502.50	94.70
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	245.92	502.50	94.70
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	177.84	369.33	71.28
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	180.00	373.04	74.41
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83
7	Reserves excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year (Other Equity) i.e. as at 31.03.2024			13,781.06
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
a)	Basic	0.94	1.94	0.37
b)	Diluted	0.94	1.94	0.37

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the quarter and half-year ended on 30th September, 2024 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

By order of the Board
Ashok Malhotra
Chairman & Managing Director
DIN - 00120198

Place : Vadodra
Date : 30.10.2024

GOVERNMENT OF INDIA
MINISTRY OF SOCIAL JUSTICE & EMPOWERMENT
DEPARTMENT OF SOCIAL JUSTICE & EMPOWERMENT

INFORMATION MEMORANDUM FOR NOTICE INVITING E-TENDER FOR Evaluation Study of three components of PM-AJAY Scheme namely Adarsh Gram, Grant in aid and Hostel

The objective under the three components are as follows:

- Adarsh Gram:**
 - (i) To measure the impact of the development undertaken in the selected villages.
 - (ii) To measure the success in complementing /supplementing the similar initiatives of the Central/State Governments schemes such as Gram Swaraj Abhiyan, Mission Antyodaya etc.
- Grants-in-aid:**
 - (i) To assess the impact of the scheme towards an increase in income and employment generation among the beneficiaries;
 - (ii) To assess the flow of fund under GIA with special attention to funds being allocated for disabled category and women;
- Hostels:**
 - (i) To study the Central Assistance funded by Govt. of India for construction expansion of pre-matric and post-matric SC hostels under Hostel component agency wise with explicit break up;
 - (ii) To evaluate civil and technical infrastructure facilities created under the scheme;

Important information on date and time schedule:

Sl. No	Particulars	Date & Time
1	Publication of NIT	18.10.2024 at 10:00 hrs
2	Pre- Bid Meeting	28.10.2024 at 10:00 hrs
3	Start date and Time of Submission of e-Tender	18.11.2024 at 10:00 hrs
4	End date and Time of Submission of e-Tender	18.11.2024 at 17:30 hrs

For more details and Notice Inviting e-Tender, please visit
<https://socialjustice.gov.in/>
and
<https://gem.gov.in/>

Vadodra

GUJARAT COTEX LIMITED
 Regd. Office: Shop No. 4, 1st Floor, Shanti Complex, Opp. Patel Pump, Amin, Silvassa - 396230. M: 93279 71729
 Email: jayprakash@gmail.com, Website: www.gclsurat.com, Corporate Identity Number: L17119DN1996PLC000116

Extract of Un-Audited Financial Result for Period Ended 30/09/2024 (Rs. in Lakhs)

Particulars	Quarter Ended	Half Year Ended	Corresponding 3 Months
	30/09/2024	30/09/2024	Ended on 30/09/2023
Total income from operations	820.44	1233.16	395.04
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	13.53	33.67	2.21
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	13.53	33.67	2.21
Equity Share Capital	712.20	712.20	712.20
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet			-48.32
Earnings Per Share (of Rs. 5/- each) (For continuing & discontinued operations)-			
1) Basic	0.10	0.24	0.02
2) Diluted	0.10	0.24	0.02

Note: The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange at <http://www.bseindia.com> and also on website of the listed entity.

For Gujarat Cotex Limited
 Shalokhankumar Jayantkumar Parikh
 Managing Director (DIN: 01246270)

Place: Surat
 Date: 29/10/2024

Panchmahal Steel Limited
 Registered Office: GIDC Industrial Estate, Kalod-389 330, Dist. Panchmahals, Gujarat.
 CIN: L27104GJ1972PLC026153, Phone No: 02676-230777, Fax No: 02676-230889
 Email: sharan@panchmahalsteel.co.in, Website: www.panchmahalsteel.co.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quater ended	Half Year ended	Corresponding 3 months
		30-09-2024	30-09-2024	30-09-2023
1	Total Revenue	9,988.26	19,873.34	12,034.16
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	245.92	502.50	94.70
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	245.92	502.50	94.70
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	177.84	369.33	71.28
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	180.00	373.64	74.41
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83
7	Reserves excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year (Other Equity) i.e. as at 31.03.2024			13,761.06
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
a) Basic	0.94	1.94	0.37	
b) Diluted	0.94	1.94	0.37	

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2024 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

By order of the Board
 Ashok Mahesh
 Chairman & Managing Director
 DIN - 00120198

Place: Vadodra
 Date: 30.10.2024

SHREE GANESH REMEDIES LIMITED
 CIN No.: L24230GJ1996PLC025661
 Registered Office: Plot No 6002, 6003, 6011 & 6012, G.I.D.C., Ankleshwar I.E., Bharuch, Ankleshwar, Gujarat, India, 393001
 Phone : 7574976076 • www.ganeshremedies.com
 Email: investors@ganeshremedies.com

EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024 (Amount in Lakhs, except as stated otherwise)

Sr. No.	Particulars	3 Months Ended	3 Months Ended	Year Ended
		30.09.2024	30.09.2024	31.03.2024
1	Total Income from Operations	3,233.19	2,477.99	12,569.54
2	Net Profit for the period (before Tax, Exceptional and/or extraordinary items)	863.61	633.18	3,816.03
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	863.61	633.18	3,816.03
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	640.59	464.88	2,810.80
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	638.24	465.62	2,815.85
6	Equity Share Capital (Face value Rs. 10/- each)	1,284.34	1,283.78	1,258.31
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	10,866.43
8	Earnings Per Share for Continuing operation (of Rs. 10/- each) (Not Annualised)			
1) Basic (in Rs.)	4.97	3.62	22.34	
2) Diluted (in Rs.)	-	-	-	

EXTRACT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024

Sr. No.	Particulars	3 Months Ended	3 Months Ended	3 Months Ended	Year Ended
		30.09.2024	30.09.2024	30.09.2023	31.03.2024
1	Total Income from Operations	3,233.19	2,477.99	3,341.53	12,569.54
2	Profit before tax	864.39	633.49	860.84	3,917.17
3	Profit after tax (after other comprehensive income)	639.20	465.83	680.51	2,816.79
4	EBITDA	1,149.51	868.87	1,002.90	4,487.74

Note: 1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on October 29, 2024.
 2. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the quarter ended September 30, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of these Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and Company's website (www.ganeshremedies.com)

For, Shree Ganesh Remedies Limited
 Chandulal Manubhai Kothia
 Managing Director
 DIN : 00652806

Place: Ankleshwar
 Date: October 29, 2024

Continue on Previous Page...

AVAILABILITY OF BID-CUM-APPLICATION FORMS: Bid-Cum-Application forms can be obtained from the Registered Office of the Company: Neelam Linens And Garments (India) Limited, Telephone: +91 22 2494 2454; BRLM: Expert Global Consultants Private Limited, Telephone: +91 11 4509 8234 and the Syndicate Member: Globalworth Securities Limited; Telephone: +91 22 6919 0011 and at the selected locations of the Sub-Syndicate Members, Registered Brokers, RTAs and CDPs participating in the Issue. Bid-cum-application Forms will also be available on the websites of NSE and the designated members of SCBSs, the list of which is available at websites of the stock exchanges and SEBI.

AVAILABILITY OF RED HERRING PROSPECTUS: Investors are advised to refer to the Red Herring Prospectus and the Risk Factors contained therein before applying in the Issue. Full copy of the Red Herring Prospectus is available on the website of the SEBI at www.sebi.gov.in, website of the Company at www.neelamlinens.com and the website of the BRLM to the Issue at www.expertglobal.in, the website of NSE, i.e. www.nseindia.com, respectively.

ESCRROW COLLECTION BANK/ REFUND BANK/ PUBLIC ISSUE ACCOUNT BANK/ SPONSOR BANK: Axis Bank Limited. UPPI: Retail Individual Bidders can also Bid through UPPI Mechanism. Investor should read the Red Herring Prospectus carefully, including the "Risk Factors" beginning on page 29 of the Red Herring Prospectus before making any investment decision.

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Red Herring Prospectus.

On behalf of Board of Directors
 For, NEELAM LINENS AND GARMENTS (INDIA) LIMITED
 sd/-
 Bhavin Jethwa
 Managing Director
 (DIN: 00050042)

Place: Mumbai
 Date: October 30, 2024

Disclaimer: Neelam Linens And Garments (India) Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public issue of its Equity Shares and will file the RHP with the Registrar of Companies, Mumbai on October 29, 2024 and thereafter with SEBI and the Stock Exchange. The RHP is available on the websites of SEBI at www.sebi.gov.in, website of the Company at www.neelamlinens.com, the website of the BRLM to the Issue at www.expertglobal.in, the website of EMERGE Platform of NSE, i.e. www.nseindia.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the RHP including the section titled "Risk Factors" beginning on page 29 of the Red Herring Prospectus. The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States, and unless so registered, and may not be issued or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and in accordance with any applicable U.S. state securities laws. The Equity Shares are being offered and sold outside the United States in "offshore transactions" in reliance on Regulation S under the Securities Act and the applicable laws of each jurisdiction where such offers and sales are made. There will be no public offering in the United States.

IRM HOLDINGS INDIA LIMITED
 (formerly known as Sudeo Industries Limited)
 Registered Office: 5th Floor, Aashoka My Home Complex, Shiloh Colony, SP Road, Begumpet, Secunderabad, Hyderabad-500083, Telangana, India.
 Website: www.irmhldia.in, Email: info@irmhldia.in, Tel. No: +91 84477 72516

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024 (Amount in Rs. Lakhs)

Sl. No.	Particulars	Quarter ended		Half Year ended		Year ended	
		30.09.2024	30.09.2024	30.09.2024	30.09.2023	31.03.2024	31.03.2023
1	Total Income from Operations	4,82,342	6,81,724	-	1,41,81,04	-	17,09,930
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2,60,320	1,71,524	-	2,147,68	-	3,184,61
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2,60,320	1,71,524	-	2,140,00	-	3,184,61
4	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	79,342	406.36	-	1,86,20	-	2,424,00
5	Equity Share Capital	3,40,221	3,40,221	-	3,40,221	-	3,40,221
6	Earnings per Equity share (nominal value of Rs. 5/- each)						
a) Basic and Diluted (Rs.)	1.11	1.23	-	2.43	-	12.91	

Note: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
 2. The above unaudited consolidated financial results have been reviewed by the Audit Committee and taken on record and approved by the Board of Directors at their meeting held on October 29, 2024 in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The statutory auditors have carried out a limited review on the consolidated financial results and expressed an unmodified conclusion.
 3. The Company's registered office has been relocated from the state of Uttar Pradesh (ROD-Kanpur) to Telangana (ROD-Hyderabad), Certificate of Registration/Regional Director Order for Change of State was granted by ROC-Kanpur on October 07, 2024.
 4. Sampada Business Solutions Limited has been acquired by IRM Holdings India Limited on 18th January, 2024 through Share Swap on account of which Sampada Business Solutions Limited has become a subsidiary (90.00%) of IRM Holdings India, 2024 and hence comparable for corresponding previous quarter and half year results are not applicable.
 5. The full financial results are available on the website of the Stock Exchange (BSE) and the Company's website: www.irmhldia.in
 6. Key Statistic Information

Particulars	Quarter ended		Half Year ended		Year ended	
	30.09.2024	30.09.2024	30.09.2024	30.09.2023	31.03.2024	31.03.2023
Revenue from Operations & Other Income	35,601	39,020	39,326	135,204	69,939	31,19,229
Profit/(Loss) before tax	1,531	68,36	6,17	10,133	6,36	97,49
Profit/(Loss) after tax	1,581	68,16	7,22	10,330	10,30	76,11

For and on behalf of the Board
 IRM Holdings India Limited
 Chairman & Managing Director
 Venkataraman Ramakrishna
 (Formerly known as Sudeo Industries Limited)
 DIN No.: 00700891

Date: October 29, 2024
 Place: Hyderabad, India

MPS MPS LIMITED
 Registered Office: 4th Floor, R.Towers IV, Super A, 16/17, LVK, Industrial Estate, Guindy, Chennai-600 032
 Corporate Offices: A-1, Tower A, 4th Floor Window II Park, Sector 125, Noida, Uttar Pradesh-201 303, CIN: L27122TN1970PLC005795
 Tel: +91 44 49162222, Email: investors@mpslimited.com, Website: www.mpslimited.com

Extract of unaudited financial results for the quarter and half year ended 30 September 2024 (INR in Lacs, except per equity share data)

Particulars	Standalone			Consolidated		
	Quarter ended	Half year ended	Corresponding quarter ended	Quarter ended	Half year ended	Corresponding quarter ended
	30 September 2024	30 September 2024	30 September 2023	30 September 2024	30 September 2024	30 September 2023
Total Income from operations	8,668	16,754	8,042	17,770	35,842	12,957
Net Profit for the quarter/period before tax	3,628	7,191	3,296	4,806	8,414	4,079
Net Profit for the quarter/period after tax	2,692	5,406	2,419	3,524	6,113	3,003
Total Comprehensive Income for the quarter/period	2,692	5,395	2,494	3,725	6,230	3,150
Equity Share Capital	1,711	1,711	33,488	1,711	1,711	1,711
Other Equity	35,398	35,398	35,398	44,271	44,271	41,004
(As on 31st March, 2024)	(As on 31st March, 2024)	(As on 31st March, 2023)	(As on 31st March, 2024)	(As on 31st March, 2024)	(As on 31st March, 2024)	(As on 31st March, 2023)
Earnings Per Share (INR 10 per equity share)						
Basic (INR)	15.87	31.87	14.26	20.77	36.04	17.70
Diluted (INR)	15.88	31.65	14.26	20.76	36.01	17.70

Note: 1. The above standalone and consolidated unaudited financial results for the quarter and half year ended 30 September 2024, have been reviewed by the Audit Committee and upon their recommendation approved by the Board of Directors of the Company at their meeting held on 29 October 2024. The Statutory Auditors of the Company have carried out limited review of the financial results for the quarter and half year ended 30 September 2024 and an unmodified review report has been issued.
 2. The above is an extract of the detailed format of standalone and consolidated unaudited financial results for the quarter and half year ended 30 September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the standalone and consolidated unaudited financial results for the quarter and half year ended 30 September 2024 are available on the Stock Exchanges websites (www.bseindia.com) and www.nseindia.com) and Company's website (www.mpslimited.com)

For MPS Limited
 sd/-
 Rahul Arora
 Chairman and CEO

Place: New York, USA
 Date: 29 October 2024

SHILP GRAVURES LIMITED
 Regd. Office: 776/6, Pramukh Industrial Estate, Sola-Santej Road, Village Rakanpur, Tal. Kalol, Dist. Gandhinagar, Gujarat - 382 722, India.
 Ph. No: 02764 - 28632324, Fax No: 02764 - 2863355 Website: www.shilpgravures.com Email: purvaloke@shilpgravures.com
STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended	Half Year ended	Year ended	Quarter ended	Half Year ended	Year ended
1	Total Income from Operations	2426.03	2318.80	2299.73	4744.83	4422.17	8651.29
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	368.81	410.02	403.35	778.83	833.45	1457.07
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	368.81	410.02	403.35	778.83	833.45	1457.07
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	291.92	382.37	316.11	674.29	690.54	1121.09
5	Total Comprehensive Income for the periods	292.35	394.64	320.75	677.19	688.37	1117.89
6	Equity share capital (Face Value of Rs.10.00/- each)	614.98	614.98	614.98	614.98	614.98	614.98
7	Reserve and Surplus	-	-	-	-	-	9174.20
8	Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters)						
a) Basic and Diluted	4.75	6.22	5.17	10.96	11.23	18.23	4.62
b) Basic and Diluted	4.75	6.22	5.17	10.96	11.23	18.23	4.62

Note: 1. The above standalone / consolidated financial results for the quarter and half year ended 30th September 2024 have been reviewed by the Audit committee and subsequently approved by the Board of Directors in their respective meetings held on 30th October 2024. These unaudited financial results have been reviewed by the statutory auditors of the Company. The statutory auditors of the Company have expressed an unmodified conclusion.
 2. The above Standalone and Consolidated Financial Results have been prepared in accordance with the guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI") and the Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013.
 3. The Company has not elected to exercise its option permitted U.S.1158A of the Income tax act, 1961 "S" and provision of current tax has been made as per the normal provisions of the Income Tax Act, 1961 "S" and rules frame there under. Further current tax for the quarter ended 30th September 2024 has been provided based on provisions of section 115B of the Income Tax Act, 1961 i.e. as per MAT (Minimum Alternate Tax).
 4. Other income includes net gain arising on sale of investment Rs. 116.29 Lacs and Rs. 255.15 Lacs for the half year ended 30th September 2024 and 30th September 2023 respectively.
 5. The Figures of previous periods have been regrouped / reclassified, wherever necessary, to make them comparable.
 6. The notes on Social Security Code ("Code") relating to employee benefits during the employment and post employment benefits provided Presidential account in September 2020. The Code has been published in official gazette of India. The effective date from which the Code is applicable is yet not notified. The Company will assess the impact of the Code when it comes to effects and will record any related impact in the period of the Code become effective.
 7. As per requirements of Regulation 33 of the Securities and Exchange Board of India, the Company is required to publish financial results. The financial results are available for general on the Company's website www.shilpgravures.com as well as on the stock exchange websites www.bseindia.com.

For Shilp Gravures Limited
 sd/-
 Mr. Arbat Patel
 Managing Director
 (DIN: 00050042)

Place: Rakanpur
 Date: 30th October, 2024

GUJEND INDIA PRIVATE LIMITED
 CIN : U74994MH2017FTC03216
 Corporate Office: Flat No. 101, 10th Floor, Durgam Chattrani Park, Ring Road, Durgam Chattrani Park, Hyderabad - 500042, India.
 Regd. Office: 23/2 Floor 2, Plot 56/81, Anandam Manjunath Park Marg, Gokul, Hyderabad - 500029, India.
 Tel: 011-48444300, Email: info@gujendindia.com, Website: www.gujendindia.com
 Extracts of the Standalone and Consolidated Financial Results for the quarter and year ended 31st March 2023

Particulars	For the Quarter ended		For the Half Year ended		For the Year ended	
	31.03.2023	31.03.2023	31.03.2023	31.03.2023	31.03.2023	31.03.2023
1	Total Income from operations	2,11,224	1,33,779	6,13,779	6,13,779	6,13,779
2	Net Loss for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	18,91	70.66	(34.59)	(494.68)	(494.68)
3	Net Loss for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	18,91	70.66	(34.59)	(494.68)	(494.68)
4	Net Loss for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(283.90)	70.66	(316.69)	(494.68)	(494.68)
5	Total Comprehensive Income (Expense) for the period/quarter	(278.41)	28.98	(405.81)	(277.81)	(277.81)
6	Equity Share Capital	789.89	789.89	789.89	789.89	789.89
7	Other Loans	1,128.16	1,128.16	1,128.16	1,128.16	1,128.16
8	Net Worth (Net Equity)	2,213.22	2,483.12	2,213.22	2,483.12	2,483.12
9	Other Unpaid Current Liabilities	2,827.48	2,827.48	2,827.48	2,827.50	2,827.50
10	Earnings per equity share (EPS) (a) Basic (in Rupees)	(0.88)	0.05	(1.29)	(1.96)	(1.96)
11	Div					

